

વંચાણમાં:- આ કચેરીના પત્ર ક્રમાંક નંબ.નં. નફ્યુ/હિનિ/વહટ/૩૨૩૯/૨૦૨૨ નવસારી, તા.૧૯/૦૪/૨૦૨૨.

પરિપત્ર


વિષય:- સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે GST-TDS ના રિટર્ન ફાઇલ કરી TDS Certificate ઈશ્યુ કરવાની કામગીરી સોંપવા બાબત.

નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ કચેરીના વડાશ્રીઓ તેમજ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓને જણાવવાનું કે, ઉપરોક્ત વંચાણમાં લીધેલ પત્ર ક્રમાંકથી નવસારી કૃષિ યુનિવર્સિટીની તમામ કચેરીઓની નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે પાર્ટીઓના બીલોના ચૂકવણીની રકમ માંથી કપાત કરવામાં આવતા GST-TDS ના રિટર્ન ફાઇલ કરી TDS Certificate ઈશ્યુ કરવાની કામગીરી **SHAP & ASSOCIATES, Surat** ને સોંપવામાં આવેલ છે. જેથી ચાલુ નાણાંકીય વર્ષની GST-TDS સંબંધી ઓનલાઇન ફાઇલિંગની સઘળી કામગીરી ઉપરોક્ત એજન્સી/ પાર્ટી દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ પાસેથી કરાવવાની રહેશે. તો દરેક કચેરી દ્વારા માસિક કરવામાં આવતા પાર્ટીઓના બીલોના ચૂકવણીની રકમ માંથી કપાત કરવામાં આવતા GST-TDS ના રિટર્ન ફાઇલ કરી TDS Certificate ઈશ્યુ કરવાની થતી હોય, જે માટે આપની કચેરીના GST-TDS ની માહિતી સમય મર્યાદામાં **(દર માસની ૧ થી ૩ તારીખ સુધીમાં)** ઉક્ત એજન્સી/ પાર્ટીના ઈમેલ ઉપર સોફ્ટકોપી મોકલી આપવાની રહેશે તેમજ ઉપરોક્ત એજન્સી/ પાર્ટી પાસેથી ચલણ મેળવી બેંકમાં ચલણમાં દર્શાવેલ રકમ **દર માસની ૧૦ તારીખ પહેલા** જમા કરાવવાની થાય છે. તેમ છતાં સમય મર્યાદામાં સદરહુ માહિતી જે તે કચેરી તરફથી પૂરી પાડવામાં નહીં આવે તો GST-TDS ના રિટર્ન ફાઇલ સંબંધી જે કોઈ પ્રશ્નો ઉપરિચિત થશે તેની સઘળી જવાબદારી નાણાં ઉપાડ અને ચૂકવણા અધિકારીશ્રીની રહેશે.

વધુમાં, સદરહુ કામગીરીના બીલોના ચુકવણા અત્રેની કચેરીથી કરવામાં આવશે જેથી અન્ય કોઈ કચેરીએ આ બાબતે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં. જેની નોંધ લેવી.

૧.	એજન્સી/ પાર્ટીનું નામ	:	SHAP & ASSOCIATES
૨.	એજન્સી/ પાર્ટીનું સરનામું અને સંપર્ક માટેની માહિતી	:	301, Deepkamal-1, Nr.zoo park,sarthana zakatnaka, varachha road, Surat-395 006 Mo: 9586048187, 9099374148 Email: shap.associates@gmail.com
૩.	સદર કામગીરી માટે એજન્સી/ પાર્ટી દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિનું નામ અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ	:	Name: Pratik J Purani Email: tender.shap@gmail.com Mo: 9099374148

ખ.નં. નફ્યુ/હિનિ/વહટ/૩૨૩૯/૨૦૨૨
નવસારી, તા. ૨૧ /૦૪/૨૦૨૨



હિસાબ નિયામક



Please consider your environmental responsibility. Before printing this circular message, ask yourself whether you really need a hard copy.

નકલ સવિનય રવાના (e-પરિપત્ર વ્હારા જાણ તથા અમલ થવા સારું):-

- (૧) અત્રેની યુનિવર્સિટીના તમામ કચેરી વડાશ્રીઓ તરફ.
- (૨) અત્રેની યુનિવર્સિટીના તમામ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓ તરફ.

નકલ રવાના (e-પરિપત્ર વ્હારા જાણ તથા અમલ થવા સારું):-

- (૧) અત્રેની યુનિવર્સિટીના વહીવટી-વ-હિસાબી અધિકારીશ્રી તરફ.
- (૨) SHAP & ASSOCIATES, Surat તરફ જાણ સારું તથા ટેન્ડરની શરત મુજબ કામગીરી હાથ ધરવાની રહેશે.

